

જાહેર નિવેદા

ખેતી નિયામકશ્રી ની કચેરી,

કૃષિ ભવન, સેક્ટર-૧૦ એ, ચ રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦

ખેતીવાડી ખાતા હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ નીચે જણાવેલ વિગતની જગ્યાઓ કરાર આધારિત ૧૧ (અગિયાર) માસ માટે ફીક્સ પગારે મેરીટ ને આધારે જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી કરી તારીખ ૦૬/૦૫/૨૦૧૭ ના રોજ ૧૮.૦૦ કલાક સુધી કે તે પહેલા ખેતી નિયામકની કચેરી, કોપ શાખા, ૩ જો માળ, કૃષિ ભવન, સેક્ટર-૧૦ એ, ચ રોડ, ગાંધીનગર ખાતે ફક્ત RPADથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

અ.નં.	જગ્યાનું નામ	માસિક પગાર (રૂપિયા)	શૈક્ષણિક લાયકાત અને અનુભવ	જગ્યાની અંદાજીત સંખ્યા
(અ) રાજ્ય કક્ષા				
૧.	કન્સલટન્ટ	૫૦,૦૦૦/-	૧. પી.એચ.ડી. ઇન એગ્રોનોમી/ એગ્રી. એક્સટેન્શન /સોઇલ સાયન્સ/પ્લાન્ટ બ્રીડીંગ/પાક સંરક્ષણ /કોપ ઇમ્પ્રુવમેન્ટ અનુભવ- પાક ઉત્પાદન/ સુધારણાનો ૧૦ વર્ષનો અનુભવ અથવા ઉપરના વિષયોમાં માસ્ટર ડીગ્રી તથા અનુભવ- પાક ઉત્પાદન/ સુધારણાનો ૨૦ વર્ષનો અનુભવ ૨. ઉમેદવારમાં આંકડાનું પૂથ્થકરણ પરીયોજના રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય જનરલમાં પ્રકાશીત થાય તેવા અહેવાલ લેખ તૈયાર કરવાની ક્ષમતા હોવી જોઈએ.	૦૨
૨.	અ. ટેકનીકલ આસીસ્ટન્ટ	૨૫,૦૦૦/-	૧. એમ.એસ.સી. (એગ્રી.) ઇન એગ્રોનોમી + કોમ્પ્યુટર સ્કીલ- કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી ૨. સંશોધન અને વિસ્તરણના અનુભવને અગ્રતા	૦૧
	બ. ટેકનીકલ આસીસ્ટન્ટ (હિસાબ)	૨૫,૦૦૦/-	૧. માન્ય વિદ્યા શાખામાં સ્નાતકની પદવી.	૦૧

			૨. રાજ્ય સરકારશ્રીના નાણા વિભાગ હેઠળની કચેરીઓમાંથી હિસાબી સંવર્ગનાં નિવૃત્ત થયેલા મુખ્ય હિસાબનીશ અથવા હિસાબી અધિકારી વર્ગ-૨ તરીકેની કામગીરીનો અનુભવ. ઉમેદવારની પસંદગી અનુભવના વર્ષોને ધ્યાને લઈને કરવામાં આવશે.	
(બ) જિલ્લા કક્ષા				
૧.	જિલ્લા કન્સલટન્ટ	૩૦,૦૦૦/-	૧. એમ.એસ.સી (એગ્રી.) ઇન એગ્રીનોમી/ એગ્રી. એક્ષટેન્શન /સોઇલ સાયન્સ/ કોપ ઇમ્પ્રુવમેન્ટ અનુભવ-પાક ઉત્પાદન/સુધારણાનો ૧૦ વર્ષનો અનુભવ ૨. ઉમેદવારમાં આગેવાની લેવાની અને પ્રોત્સાહન આપવાની ક્ષમતા હોવી જોઈએ.	૨૫
૨.	ટેકનીકલ આસીસ્ટન્ટ	૨૦,૦૦૦/-	૧. બી.એસ.સી (એગ્રી.) + કોમ્પ્યુટર સ્કીલ ૨. સંશોધન અને વિસ્તરણા અનુભવને અગ્રતા	૧૫

નોંધ : ઉપરોક્ત જગ્યાઓ માટે રાજ્ય સરકારશ્રીની સેવા/ બોર્ડ- નિગમ /યુનિવર્સિટી માંથી નિવૃત્ત થયેલા ૬૨ વર્ષ કરતા ઓછી વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને નિમણુક હુકમ રાજ્ય સરકારશ્રીનીમંજુરી મળયેથી આપવામાં આવશે.